

ડિસેમ્બર 7, 2018

સેલિબ્રેટ 12 ડેઝ ઓફ ક્રિસમસ વીથ બ્રામ્પટન એનિમલ શેલ્ટર! (નાતાલ નિમિત્તે 12 દિવસ બ્રામ્પટન એનિમલ શેલ્ટર સાથે ઉજવો!!)

બ્રામ્પટન, ઓન્ટેરિયો – ભલે તમે તમારી રજાઓનો સમય તમારા રૂવાંટીદાર મિત્ર સાથે વિતાવો, તમે જરૂરિયાતમંદ પ્રાણીઓને સહાયતા કરવા ઈચ્છો, અથવા તમને બસ પ્રાણીને લગતી બધી બાબતો ગમતી હોય, એમ ગમે તે હોય તમને આગામી 12 દિવસ ભાગ લેવાની ઈચ્છા થશે.

બ્રામ્પટન એનિમલ શેલ્ટર નાતાલ પ્રસંગે આ ઋતુમાં ડિસેમ્બર 7 થી 18, 2018 સુધીના 12 દિવસ હર્ષનાદ ફેલાવવાનું છે.

તમે અને તમારા ચારપગા મિત્રને આ ગીર્વાંગ બેક ઈવેન્ટ્સમાં (પાછું આપવાના આયોજનોમાં) અને મોટા ઈનામો જીતવાની તક લેવા અમારી સાથે જોડાવા અને ઉન્સવી પ્રવૃત્તિઓ માટે અમારી મુલાકાત લેવાનું નિમંત્રણ આપવામાં આવે છે.

તમે કેવી રીતે સામેલ થઈ શકો છો?

ડિસેમ્બર 7 – એક એડપ્શન ગીફ્ટ સર્ટિફિકેટ (દત્તક ભેટ પ્રમાણપત્ર) ખરીદો.

ડિસેમ્બર 8 – ડોગટોપિયા બ્રામ્પટનમાં (17 વર્ધિંગટન એવન્યુમાં) બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી તમારા સેન્ટા પેટ ફોટાઓ મેળવો. બિલાડીઓ પણ આવકાર્ય છે!

ડિસેમ્બર 9 – બ્રામ્પટન એનિમલ સર્વિસીસ [Facebook પાન](#) પર અમારી હોલિડે પેટ ફોટો સ્પર્ધામાં પ્રવેશો. સૌથી વધારે પસંદ પામેલો ફોટો એક ગીફ્ટ બાસ્કેટ મેળવશે.

ડિસેમ્બર 10 – હેલિંગ ઓફીન્ડ પેટ્સ ઈન ઈમરજન્સીસ (હોપ - HOPE) ફંડમાં દાન આપો અને તમારા પેટ (પાળેલા પ્રાણી) માટે હેન્ડ-લેટર્ડ સ્ટોર્કિંગ (હાથેથી દોરેલા અક્ષરોવાળા ઘૂંટણ સુધીના ગૂંથેલા મોજા) મેળવો.

ડિસેમ્બર 11 – HOPE ફંડમાં દાન આપો અને પર્સનલાઈઝ્ડ પેટ ટેગ મેળવો.

ડિસેમ્બર 12 – હાથબનાવટના પેટ ક્રાફ્ટ્સ સેલમાંથી ખરીદી કરો.

ડિસેમ્બર 13 – અમારા હાથબનાવટના ઓરનામેન્ટ્સ (આભૂષણોના) સેલમાંથી ખરીદી કરો.

ડિસેમ્બર 14 – અમારા પેટ બેક સેલમાંથી બેકડ ગુડીસ (બેકરી ખાદ્યપદાર્થો) ખરીદો.

ડિસેમ્બર 15 – એમેઝોન વિશ લિસ્ટ વસ્તુઓ એકઠી કરો.

ડિસેમ્બર 16 – ઓનલાઇન દાન આપીને અમારા HOPE ફંડને સહાયતા કરો.

ડિસેમ્બર 17 – સ્ટફ્ડ એનિમલ (ઊનવાળા પ્રાણીનું રમકડું) દત્તક લો.

ડિસેમ્બર 18 – અમારા મફત માર્શ્કોચિપ ક્લિનિકની મુલાકાત લો. માત્ર બ્રામ્પટન રહેવાસીઓ માટે. તમારે સીમિત જગ્યા હોવાને લીધે, અગાઉથી નોંધણી અચૂક કરાવવી. 905.458.5800 નંબર પર ફોન કોલ કરીને નોંધણી કરાવો.

રૂબરૂમાં પ્રસંગોનું આયોજન બ્રામ્પટન એનિમલ શેલ્ટરમાં (475 કાર્લસ્વર ડ્રાઇવમાં) કરવામાં આવશે, અન્યથા યાદીબદ્ધ હોય તે સિવાય, સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી. તમામ આવક અમારા HOPE ફંડને દાનમાં આપવામાં આવશે.

આમાંના કોઈપણ આયોજન પર વધુ માહિતી માટે વેબસાઇટ જુઓ, www.brampton.ca/animalservices

અવતરણ (ક્વોટ):

“ગીવીંગ બેક (પાછું આપવું) એ રજાઓના દિવસોનો એક મહત્વનો ભાગ છે – તેમાં આપણાં ચારપગા મિત્રોને પરત આપવાનો સમાવેશ થાય છે! બ્રામ્પટન એનિમલ શેલ્ટર આ વર્ષે નાતાલ નિમિત્તે આનંદભર્યા 12 દિવસનું આયોજન, એડપ્શન ગીફ્ટ સર્ટિફિકેટ્સ (દત્તક ભેટ પ્રમાણપત્રો) આપવા, HOPE ફંડ માટે દાન એકઠું કરવા અને મફત માર્શ્કોચિપ ક્લિનિકનું આયોજન કરવા પણ કરી રહ્યું છે. તમારે પેટ (પાળેલું પ્રાણી) હોય કે ના હોય, 12 દિવસ સહભાગી થઈને આ રજાઓના સમયમાં આપણાં સમુદાયમાં સામેલ થવાની આ એક ચડિયાતી રીત બની રહેશે.”

- મેયર પેટ્રિક બ્રાઉન

-30-

બ્રામ્પટન વિશાળ આયોજનો વિષે વિચારો છે. અમે તીક્ષ્ણ ફોકસ ધરાવતા ભવિષ્ય માટે તૈયાર સંગઠન છીએ. અમે જાણીએ છીએ કે આપણા સમુદાયની વૃદ્ધિ, યુવાની અને વૈવિધ્ય આપણને અલગ ઓળખ પ્રદાન કરે છે. અમે કનેક્ટના ઈનોવેશન સુપર કોરિડોર ખાતે સ્થિત છીએ જ્યાં રોકાણોને પ્રોત્સાહિત કરીએ છીએ અને વૈશ્વિક સ્તરે અમારી સફળતામાં વૃદ્ધિ કરી રહ્યા છીએ. અમે બનાવી રહ્યા છીએ એવા ગતિશીલ શહેરી કેન્દ્રો જે તકોનો તણખો ચાંપે છે અને અહીં કામ કરતા લોકોમાં ગૌરવની લાગણીનો સંચાર કરે છે. અમે બ્રામ્પટનને આગળ ધપાવી રહ્યા છીએ જેથી તે એક જોડાણ ધરાવતું શહેર બને જે પ્રવર્તનાત્મક, વ્યાપક અને સાહસિક હોય. અમને [Twitter](https://twitter.com/brampton) અને [Facebook](https://facebook.com/brampton) પર ફોલો કરો. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

મીડીઆ સંપર્ક

મેનિકા ડુગ્ગલ (Monika Duggal)

વેબસાઇટનેટવર્ક, મીડીઆ ઍંડ વમિઉનિટી ઐનગોવર્નમેન્ટ

સ્ટ્રેટજિક વમિઉનિવેસ્ટ

સિટી ઓફ બ્રામ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca